

## ઈમામે ઝમાના<sup>(અ.સ.)</sup>ની યાદ

“અમે તમારા કાર્યોથી ગાફિલ નથી તેમજ તમારી યાદને ક્યારેય ભુલતા નથી.”

અઝીઝો! આજે આપણા ઈમામ<sup>(અ.સ.)</sup> ગયબતમાં છે તેનો મતલબ હરગીઝ એમ નથી કે તેઓ આપણાથી ગાફિલ છે પરંતુ આજે તેઓ આપણું ધ્યાન રાખી રહ્યા છે. આપણે જાણીએ છીએ કે ઈમામ<sup>(અ.સ.)</sup>ને ગયબતમાં ગયાને ૧૧૮૦ વર્ષ વીતી ગયા પરંતુ હજુ સુધી ઈમામ<sup>(અ.સ.)</sup>નો ઝુહુર નથી થયો. તો શું આ ગયબતના ઝમાનામાં આપણી પણ કંઈ જવાબદારીઓ અને ફરજો છે? હા. અઝીઝો! આ ગયબતે કુબરાના ઝમાનામાં શીઆઓની ઘણી બધી જવાબદારીઓ છે. જેમકે ઈમામ<sup>(અ.સ.)</sup>ની મઅરેફત મેળવવી, તેમનો ઈન્તેઝાર કરવો, તેમના ઝુહુર માટે દોઆ કરવી, વિગેરે. આ પૈકી આપણી એક મહત્વની જવાબદારી છે કે આપણે ઈમામ<sup>(અ.સ.)</sup>ને યાદ કરવા જોઈએ.

તો અઝીઝો! અહીંયા એક સવાલ થાય કે શું ઈમામને આપણી યાદની જરૂર છે કે તેમને યાદ કરવામાં આવે? તો આનો સ્પષ્ટ જવાબ આપણને એક હદીસ દ્વારા જાણવા મળે છે જેમાં

“ઈમામ<sup>(અ.સ.)</sup>ની મિસાલ ખાનએ કા'બા જેવી છે,

ખાને કા'બા લોકોના ઘરે નહિ આવે પરંતુ લોકોની એ જવાબદારી છે કે તેઓ ખાનએ કા'બા સુધી જાય.”

જેવી રીતે આપણે હદીસમાં સાંભળ્યું કે ખાનએ કાબા લોકોના ઘરે નથી આવતું. પરંતુ લોકોએ ખાનએ કાબા તરફ જવું જોઈએ તેવી જ રીતે ઈમામ<sup>(અ.સ.)</sup>ને આપણી જરૂર નથી પરંતુ આપણને ઈમામ<sup>(અ.સ.)</sup>ની જરૂર છે. અગર આજે આપણે ઈમામ<sup>(અ.સ.)</sup>ને યાદ ન કરીએ તો એમને કોઈ ફર્ક નથી પડવાનો પરંતુ અગર આપણે ઈમામ<sup>(અ.સ.)</sup>ને યાદ કરીશું તો આપણા માટે નજાત છે. ફક્ત એટલું જ નહિ પરંતુ તે વડે આપણી ઈમામ<sup>(અ.સ.)</sup>ની પ્રત્યેની લાગણી અને મોહબ્બત જાહેર થશે.

ઈન્સાન કોઈને ક્યારે યાદ કરે છે? જ્યારે તેની સાથે મોહબ્બત હોય છે. જેમકે વાલેદૈનની મોહબ્બત પોતાની ઔલાદ સાથે, ઔલાદની મોહબ્બત પોતાના વાલેદૈન સાથે, ભાઈની મોહબ્બત પોતાની બહેન સાથે, બહેનની મોહબ્બત પોતાના ભાઈ સાથે. આ બધા સંબંધોમાં યાદ કરવાનું માપદંડ મોહબ્બત છે.

આવીજ રીતે એહલેબૈતે અત્હાર<sup>(અ.મુ.સ.)</sup>ની મોહબ્બતના બારામાં ઈમામ સાદિક<sup>(અ.સ.)</sup> એક હદીસમાં ઈરશાદ ફરમાવે છે કે “બેશક દરેક ઈબાદતથી બહેતર ઈબાદત છે અને અમો એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>ની મોહબ્બત સૌથી અફઝલ ઈબાદત છે.”

તો આપણે અલ્લાહનો આ એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>ની મોહબ્બતની અઝીમ નેઅમત ઉપર જેટલો શુક્ર અદા કરીએ તેટલો ઓછો છે. કારણકે અલ્લાહે આપણને એવા ખાનદાનમાં પૈદા કર્યા છે કે જ્યાં પાણી અને ખોરાકની જેમ એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>ની મોહબ્બત આપણને આપવામાં આવી છે.

બીજી એક હદીસમાં આપણા આખરી પયગમ્બર હઝરત મોહમ્મદે મુસ્તફા<sup>(સ.અ.વ.)</sup> ઈરશાદ ફરમાવે છે કે “અગર કોઈ ચાહતો હોય કે તેનું ઈમાન સંપૂર્ણ ઈમાન હોય અને તેનો ઈસ્લામ શ્રેષ્ઠ ઈસ્લામ હોય તો તેના ઉપર જરૂરી છે કે તે હુજ્જત સાહેબુઝઝમાન અલ મુન્તઝર<sup>(અ.સ.)</sup>ને મોહબ્બત કરે. જે કોઈ આ અઈમ્મા<sup>(અ.મુ.સ.)</sup>ને મોહબ્બત કરે, તેની વિલાયતને કબુલ કરે તો હું અલ્લાહ તરફથી તેના માટે જન્નતની ઝમાનત લઉં છું.”

એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>ની મોહબ્બતમાં વધારો કરવાનું એક માધ્યમ તેઓની યાદ છે. તેઓને યાદ કરવાના ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે આપણે શૈતાનના વસવસાથી મહેફુઝ રહેશું.

એક બુઝુર્ગ આલીમે દીન પોતાના શાર્ગીદોને કહેતા હતા કે શૈતાન આપણી કરતા વધારે હુશીયાર છે. તેણે અલ્લાહને વાયદો કર્યો છે કે તે બની આદમને બહેકાવશે અને આ માટે તે અલગ અલગ તરીકાઓ અપનાવે છે.



આ શૈતાનની જાળમાંથી બચવાનો સૌથી આસાન અને સૌથી વધારે કામ્યાબ તરીકો એ છે કે આપણે આપણી અને શૈતાનની વચ્ચે એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>ની યાદને ઢાલ બનાવીએ કારણકે શૈતાન તે લોકોથી દૂર રહે છે જેઓ એહલેબૈત<sup>(અ.મુ.સ.)</sup>ની યાદમાં મશ્ગુલ હોય છે.

આપણે ઈમામ<sup>(અ.સ.)</sup>ને યાદ કરવાનું મહત્વ, તેનો ફાયદો જોયો, હવે આપણે જોઈએ કે ઈમામ<sup>(અ.સ.)</sup>ને યાદ કેવી રીતે કરવા? તો આના બારામાં ઈમામ સાદિક<sup>(અ.સ.)</sup> તેમના મશ્હુર સહાબી દાઉદ બીન સરહાનને ફરમાવે છે:

“અય દાઉદ! મારા સલામ અને મારો પયગામ એ શીઆઓ સુધી પહોંચાડી દયો કે જ્યારે બે વ્યક્તિઓ આપસમાં મળે અને અમારી હદીસોની ચર્ચા કરે તો અલ્લાહની તે બંને ઉપર રહેમત હોય છે અને તે બંને દરમ્યાન ત્રીજી વ્યક્તિ એક ફરિશ્તો હોય છે કે જે તે બંને માટે ઈસ્તેઝ્ફાર કરે છે. કોઈપણ બે વ્યક્તિ આપસમાં મળી અને અમારો ઝીક નથી કરતા સિવાય કે અલ્લાહ ફરિશ્તાઓ સમક્ષ આ બાબતે ફિખ્ર કરે છે. હું તમને હુકમ આપું છું કે જ્યારે પણ તમે આપસમાં મળો તો અમારી યાદમાં મશ્ગુલ રહેજો. આ અમારી યાદ અમારા અમ્રોને જીવંત કરે છે. અમારી પછી શ્રેષ્ઠ લોકો એ છે કે જેઓ અમારી હદીસોને બયાન કરે છે અને લોકોને અમારી તરફ દઝવત આપે છે.”

अगर आपणो आ उदीस उपर गौरो ईक करीअे तो  
ईमाम<sup>(अ.स.)</sup>अे आ उदीसमां घाणी बधी बाबतो तरई  
ईशारो कर्यो ऐ जेमके:

१) ज्यारे पाणु बे व्यकितओ अेहलेबैत<sup>(अ.मु.स.)</sup>नो ठिक  
करे तो तेमां त्रीज्ज व्यकित अेक इरिस्तो होय ऐ.

२) ते इरिस्तो ते मजलीसमां उाजर रहेला लोको माटे  
ईस्तेफार करे ऐ.

३) मअसुम ईमाम<sup>(अ.स.)</sup> सतत ते शप्स माटे ढोआ करे  
ऐ के जे तेमनी उदीसोनी यर्या करे ऐ.

४) ईमाम सादिक<sup>(अ.स.)</sup> आ उदीसनी अंदर आपणने  
हुकम करे ऐ के तमे लोको भेगा थाव अने अमारी उदीसोनी  
यर्या करे.

५) ज्यारे पाणु आ उदीसोनी यर्या करवामां आवे ऐ तो  
अेहलेबैत<sup>(अ.मु.स.)</sup>ना अम्रो ज्वंत थाय ऐ.

६) षुढ अदलाह तआला आवी व्यकितओ उपर  
इरिस्ताओ समक्ष नाज करे ऐ.

७) आवा प्रकारना लोको श्रेष्ठ लोको होय ऐ.

मौला! अमारा दीलोमां आपनी जे मोहब्बत अने  
याद ऐ ते कबुल करी लयो अने अमने तौईक दयो के  
अमे हुंमेशा तमने याद करता रहीअे अने जिंदगीना  
आपरी श्वास सुधी तमने भुलीअे नहि.

प्रकाशक : हाजिनाजि मेमोरियल ट्रस्ट

वेबसाईट : [www.hajinaji.com](http://www.hajinaji.com) ईमेल : [hajinajitrust@gmail.com](mailto:hajinajitrust@gmail.com)